

Asian Granito India's Rs. 441 Cr Rights Issue to open on April 25

Ahmedabad, Asian Granito India Limited (AGL), one of the largest Luxury Surfaces and Bathware Solutions brands in the country is scheduled to open its Rs. 441 crores Rights Issue on April 25, 2022. Rights issue proceeds will be utilised to fund its Mega Expansion Plans, set up three new state-of-the-art manufacturing facilities at Morbi, Gujarat in Value Added Luxury Surfaces & Bathware Segments including GVT Tiles, Sanitaryware and SPC Flooring, setting up one of the India's largest Display Centre, funding the working capital requirements of the above new projects and general corporate purposes. Shares under the Issue are offered at a price of INR 63 per Share i.e. 46.6% discount to the closing share price of Rs. 118 per share on April 06, 2022 on NSE. The Issue will close on May 10, 2022.

The Company will issue approximately 7,00,00,000 fully paid-up Equity Shares

of face value of INR 10 each for cash at a price of INR 63 per Equity Share (including a premium of INR 53 per Equity Share) aggregating INR 441 crore on a rights basis to eligible equity shareholders in the ratio of 37:30 (37 Equity Shares for every 30 Equity shares fully paid-up Equity Share held by the Eligible Equity Shareholders). Company has fixed April 12, 2022 as record date for the purpose of determining equity shareholders entitled to receive the rights entitlement in the rights issue.

The Promoter & Promoter Group shareholders have confirmed their participation of up to 28.99% shareholding (i.e. upto 100% of their current shareholding) amounting to Rs. ~128 crores. Promoter and Promoter Group shareholders have also indicated that in case the the Issue is undersubscribed, they reserve the right to subscribe to part or the whole amount of the unsubscribed portion,

subject to applicable laws. Post completion of the Issue, total outstanding shares of the Company would increase to 12,67,51,634 equity shares from 5,67,51,634 equity shares as on March 31, 2022. Pantomath Capital Advisors Pvt. Ltd. is the sole lead managers to the rights issue.

Commenting on the development, Mr. Kamlesh Patel, Chairman and Managing Director, Asian Granito India Ltd said, "AGL has lined up major expansion plans in Morbi region in the state of Gujarat, keeping in mind strategic locational advantages, proximity to the raw material sources, easy & quick availability of manpower, proximity to some of the country's largest ports, among others. With commercialisation of the proposed plans, AGL is expected to strengthen its position as an Integrated Luxury Surfaces and Bathware Solutions Brand and up the Group's margin profile in near to medium term."

Nykaa launches "Superstore" to partner with retailers in Gujarat

Ahmedabad, Nykaa, India's leading online lifestyle retail destination has recently launched "Superstore by Nykaa" - a



tech-forward, direct-to-retail distribution business for the Indian retailer ecosystem. An intuitive and easy to use app, Superstore is available for retailers across India.

With Nykaa Superstore, retailers in Gujarat can access the entire range of beauty, personal care & wellness products on one single platform, at distributor prices. More importantly, it gives retailers the freedom to order 100% genuine products, as much and as often as they need, delivered to their doorstep. The transparency in pricing and offers, and easy returns

make this a dependable channel to secure the most relevant products.

Superstore also helps retailers understand the

popular products in their locality, check the latest offers and profit margin for each SKU and choose the quantity while purchasing. The app currently enables brands to run trade schemes for their SKUs as well and also offers credit facility to retailers Speaking about the launch, Vikas

Gupta, CEO, Nykaa B2B said, "Superstore By Nykaa aims to serve the rising demand for beauty, personal care & wellness products in India through a user-friendly, single platform for retailers with valuable services such as credit, transparent profit margins, and fast doorstep deliveries. Staying true to the Nykaa promise of offering the best brands, trends and pricing, Superstore empowers retailers with access to an unparalleled catalogue of most relevant brands for their own customers." Leveraging the latest in technology, Superstore promises to help retailers stock the best selling categories, brands and sizes; reduce their inventory and working capital needs, and improve profitability. They can read ratings and reviews, see consumer trends, and access the latest innovations in the category, previously unavailable in physical retail.

IIFL Home Finance launches 8th Chapter from the flagship 'Kutumb' series

Ahmedabad, IIFL HFL, India's fastest growing digital first home finance company, organised the 8th Chapter of its flagship event 'Kutumb', and 2nd in collaboration with Asian Development Bank (ADB). 'Kutumb' is an initiative by IIFL HFL to promote Green Affordable Housing in India. The event took place at YMCA on 5th April in the presence of Mr. Lochan Sehra, Municipal Commissioner, Ahmedabad Municipal Corporation; Mr. Yamal Vyasa, Director, National Housing Bank; Ms. Priya Sunder, Senior Investment Officer, ADB; Mr. Sandeep Virmani, Director, Hunnarshala Foundation; Mr. Saswat Bandyopadhyay and Smruti Jukur as chief guests.

The 8th chapter of 'Kutumb', in Ahmedabad titled 'Green Gujarat' is focused on affordable, low-carbon and resilient homes. This chapter is the first multicity Kutumb, simulta-

neously conducted in Ahmedabad, Bhuj and Surat, via hybrid model. The programme witnessed over 200 builder attendees, enhancing the reach to every corner of Gujarat on the subject.

The home finance company has disbursed maximum subsidy in the state of Gujarat amounting over Rs 300 cr to more than 12,400 beneficiaries. The aim is to target over Rs 5,000 cr of home loans in next 5 years, within the region of Gujarat.

Speaking on the event Mr. Monu Ratna, ED and CEO, IIFL HFL said, "According to NAREDCO, Gujarat will need nearly 40 lakh houses in the next 5 years and 70% of these would have to be in the affordable housing segment. As an enabler of green affordable housing finance, IIFL Home Finance is encouraging people through its Kutumb initiative to get as many green homes as possible. This chapter of Kutumb is first multicity

Kutumb, covering Ahmedabad, Surat and Bhuj, via hybrid model."

The event was conducted in a panel discussion format supported by presentations. The panels focused on increasing awareness among various stakeholders about climate risk mitigation. Also, to promote the adoption of green certified housing standard in the affordable housing segment. The home finance company has been focusing on easing the journey of the customer journey by digital intervention at various touchpoints.

In the series of Kutumb, the next event, 9th Chapter is likely to be scheduled in Hyderabad, where IIFL HFL and ADB aim to bring together the affordable housing developers, planners, architects, consultants and potential homebuyers on one forum and address subjects relevant to green affordable housing in the area.

Toyota Kirloskar Motor Showcases the Newly Launched 'Cool New Glanza' at Infinitum Toyota in Ahmedabad

Ahmedabad, Toyota Kirloskar Motor (TKM) today showcased its newly launched- The Cool New Glanza, Infinitum Toyota in Ahmedabad. Present at the event were Mr. Ajit Mehta, Dealer Principal and Mr. Jigar Shah, CEO from Infinitum Toyota.

The Cool New Glanza is the most exciting and much-awaited offering in the hatchback segment of Toyota. Toyota's most affordable offering in India, the Cool New Toyota Glanza is all-set to woo customers with additional affordable variants, advanced features, dynamic look, sporty design & low cost of maintenance, making it a perfect value proposition in the segment.

A cool integration of advanced technology and

Toyota signature front fascia, exclusively designed by Toyota engineers, the Cool New Glanza boasts of an advanced connected feature, the Toyota i-Connect - one app with one stop solution of connected features, ser-



vice & value-added services developed to appeal to the modern & tech-savvy customers.

Ensuring convenience to the contemporary customers, technologies such as the Head-up display, 360-degree camera and 9-inch smart play cast, will not only allow control via a

smartphone (Apple & Android) but will also ensure that the user is always in control and connected on the go. Under the hood, the Cool New Glanza features a powerful yet fuel-efficient 'K-Series Engine' and comes with a Manual Transmission (MT) as well as an Automatic Transmission (AMT). The engine capacity of the new Glanza is 1197cc with power output of 66 KW (89 PS) to deliver a superior driving experience. The product will be introduced with two new affordable grades to the existing line-up

- E (New), S (New), G, V. Safety is paramount to Toyota, hence the Cool New Glanza comes with the most impressive set of advanced safety features that include 6 airbags, ABS with EB, VSC, ISOfix, a TECT body and Hill Hold Control.

War in Ukraine to lower growth, increase inflationary pressures globally: KPMG

New Delhi, April 6 (IANS) The ongoing conflict in Ukraine is set to lower global growth prospects and increase inflationary pressures across the world, according to global advisory firm KPMG's latest Global Economic Outlook.

The bi-annual report provides economic forecasts and analysis from the global organization's team of economists in territories and regions throughout the world.

In the report, it warns that progress on global issues including public health and climate change has slowed as political and business leaders grapple with the broad implications of the war in Ukraine.

"The global economy emerged from the Covid-19 recession with higher public debt and as central banks raise interest rates, the servicing cost of sovereign debt also increases, making it particularly challenging for emerging countries

whose debt is denominated in an appreciating US dollar," it said.

With policymakers and many businesses still reeling from the consequences of the pandemic, they are less ready to counter another significant economic shock, it opined.

On the global economic outlook, it said that the next two years will depend on how the conflict between Russia and Ukraine evolves.

"Before the outbreak of war in Ukraine, different territories and regions were at different

stages of their post-Covid-19 economic recovery, and that is reflected in the analysis from our Chief Economists. But, while GDP forecasting varies, there are a number of clear, consistent themes and threats facing the planet. Armed conflict may currently be restricted to Eastern Europe, but it's already having far-reaching consequences for all nations," said Gary Reader, Global Head of Clients and Markets at KPMG.

જાહેર નોટીસ

જન રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ અમદાવાદ સપ્ત-ડિસ્ટ્રિક્ટ અને તાલુકા અમદાવાદના ઘટલોડીયાની સીમા સર્વે નં-૨૭/૧, ફાઇનલ પ્લોટ નં-૨૦૨/એ, ટી.વી.સ્ટ્રીમ નં-૨ બીનાબેનીની જમીનમાં આવેલ અનાર ઘટલોડીયા કો.ઓ.હા.સો.લી. તેમાં આવેલ યુનિટ નં-૨૨ શ્રીમાન જીનેન્ડભાઈ ગોડાલાલ પંચાની સ્વતંત્ર માલિકી કમ્પ્લેક્સ ભોગવટની આવેલ છે અને અનાર ઘટલોડીયા કો.ઓ.હા.સો.લી. ઘટલોડીયાના રોકેટરી અને ચેરન દ્વારા જીનેન્ડભાઈ ગોડાલાલ પંચાને આપવામાં આવેલ છે સર્ટીફિકેટ નં-૬૬ શી ૭૦ ના.૦૬/૦૫/૧૮૮૫ ના રોજનાં આપેલ છે. જે અસલ યુથ બુય છે યાને મળી આવેલ નથી તો આ જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, જે ક્રોઈને અસલ છે સર્ટીફિકેટ મળેલ હોય તેઓએ નીચેના સરનામે જાણ કરવી અને તે શેર સર્ટીફિકેટના આધારે ક્રોઈપણ જાનની મોગેજ, લોન, વેપાજ, બીસીકે કે અન્ય કોઈ રીતે ટ્રાન્સફર, એસાઈન કે અન્ય ક્રોઈ વ્યવહાર કરેલ હોય તો તેની દિન-૧૫ માં જાણ કરવી અને જો ક્રોઈ વાંધો આવશે નહીં તો ડુબીકેટ શેર સર્ટીફિકેટ માટે સોસાયટીમાં અરજ કરવામાં આવશે. તેની જાહેર જનતાએ નોંધ લેવી.

દેવાંશ જે. દવે
અમદાવાદ. તા. ૦૭/૦૪/૨૦૨૨
શ્રી.કેમ. એલ.એલ.એમ. (એડવોકેટ)
૪૫, શાહનગર સોસાયટી, નવા વિકાસરોડ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૩ (મો). ૯૮૯૭૦ ૮૩૧૮૦

WESTERN RAILWAY-VADODARA DIVISION

ENGINEERING DEPARTMENT

MAINTENANCE OF SWIMMING POOL & SUPPLY OF POTABLE WATER

E-tender Notice No. DRM-BRC 001 to 002 of 2022-23. Sealed Tenders for and on behalf of the President of India are invited by Divisional Railway Manager (WA/C), Western Railway, Pratnagar, Vadodara-390 004 for the following works. **Sr. No. 01 & Tender No. & Name of Work : DRM-BRC 001 of 2022-23** Pratnagar (PRTN): Maintenance of swimming pool including providing life guard services as per prescribed scheduled for 24 months (Re-invited) (R-2). **Approximate cost of the work (in ₹) :** 6,09,517.20 **Earnest Money to be deposited (in ₹) :** 12,200.00 **Sr. No. 02 & Tender No. & Name of Work : DRM-BRC 002 of 2022-23** Supplying of potable water by Road tanker at various stations on Dabhoi (DB)-Ektia Nagar (EKNR) section for 365 days under the jurisdiction of SSE (Works) Dabhoi, ADEN (N) BRC. **Approximate cost of the work (in ₹) :** 5,28,307.00 **Earnest Money to be deposited (in ₹) :** 10,600.00 **For all above Tenders : Date and time for submission of tender and opening of tender :** Tender is to be submitted on 25.04.2022 before 15.00 Hrs., and is to be opened on same date at 15.30 Hrs. **Website particulars and notice for location where complete details can be seen & Address of the office from where the tender can be purchased:** Website @ www.iireps.gov.in Divisional Railway Manager (WA/C), Western Railway, Pratnagar, Vadodara-4. **W623/INIT of 2022-23 dated 02.04.2022**

Like us on: www.facebook.com/WesternRly

WESTERN RAILWAY - VADODARA DIVISION

SIGNAL & TELECOMMUNICATION DEPARTMENT

E-TENDER NOTICE

Tender Notice No. S&T/BRC/21-22/38/TELE date: 01.04.2022. Sr. DS/TE/ Vadodara acting for and on behalf of The President of India invites E-Tenders against **Tender No. SandT_BRC_21-22_38 TELE** Bidders will be able to submit their original / revised bids upto closing date and time only. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. **(1) Name of work with its location:** Vadodara Division: Part Supply of Telecom Materials and Installation, Testing & Commissioning in connection with the work "Replacement of Mechanical lifting barrier (MLB) and Semaphore signal with Electrical Lifting Barrier (ELB) and CLS at 7 LC gates in ANND - CBY section (3, 4, 6, 15, 17, 24 & 32)". **(2) Approx. cost of the work: ₹ 10,37,820.84/- (3) Earnest Money to be deposit: ₹ 20,800/- (4) Date & time for submission of e-tender and opening of e-tender:** 29.04.2022 @ 15:00 Hours and 29.04.2022 @ 15:30 Hours; **(5) Web side particulars and notice for location where complete details can be seen etc.** <http://www.iireps.gov.in> Senior Divisional Signal & Telecommunication Engineer, 2nd Floor - Annex Building, DRM's Office, Western Railway, Pratnagar, Vadodara-390 004

Like us on: www.facebook.com/WesternRly

Gujarat Mineral Development Corporation Ltd.

(A Government of Gujarat Enterprise)

Khanji Bhavan, 132 Feet Ring Road, Near University Ground, Vastapur, Ahmedabad-380 052

GMDC Invites following Tenders for Akrimota Thermal Power Station at Village- NaniChher, Taluka- Lakhpat Dist. Kutch

S.No	Tender No.	Tender Name
1.	GMDC/ATPS/Boiler ESP Repairing- 41/22-23	Repairing work with Supply of materials for ESP PASS A&B of Unit #2 at 2x125MW Akrimota Thermal Power Station

• Tender document can be downloaded from the GMDC website (nprocure portal (<https://gmdc.nprocure.com>)).

• Bids shall be required to be submitted online on the nprocure portal (<https://gmdc.nprocure.com>).

INF/ABD/36/2022

- General manager (Power)

EXPLORING LIMITLESS POSSIBILITIES

WATER IS LIFE

DISTRICT WATER AND SANITATION UNIT, VALSAD

E-TENDER NOTICE NO.E-02 OF 2022-23

Tender ID Number: 516127, 516130, 516134 (Second Trial)

Unit Manager's Office, District Water and Sanitation Unit, Valsad Ashish Building, 1st Floor, Opposite Powerhouse, Madanwad, Narandas Patel Road, Valsad-396001 contact No 02632-242595 on Behalf of Village Water & Sanitation Committee Online tenders are invited through the E-Tendering Method for the following work (1) Work Name - Distribution Pipeline, Home Connection, Repairing Home Connection, Pumping Machinery, Readymade Pump Cabin, Repairing RCC ESR 20000Lit. Capacity 5MT Height, Repairing RCC HGLR 20000Lit. Capacity and Wall Slogan Writing (2) Total 03 Works Amount from Rs.109.05 lacs to Rs.121.83 lacs Total Rs.349.53 lacs (3) Eligibility of the agency should be registered with the Government Department of R&B, Irrigation and Panam Project Department in Registration C and above and kept in tender document. As per the provision (4) The Starting date of online tender is **07/04/2022, from 12:00 hrs** to last date for submission of online tender is **13/04/2022, till 18.00 hrs.** (5) Last date of physical submission of the tender fee and EMD- The very Next day of last date of online Submission upto 15.00 hrs. by **SPEEDPOST/POST/COURIER/PERSONALY** (6) EMD exemption certificate will not be accepted for EMD amount. E-tenders for the said operation will be available on the website www.nprocure.com and will have to be filled online on this site. Further details of the tender will be posted on the above website. The power to cancel any or all tenders without giving reason shall be vested in the competent authority. Other terms and conditions related to the tender can be obtained from the online document.

For any related complaints/suggestions related to water in rural areas, please contact on **toll free no.1916.**

INF/Valsad/09/2022

Symphony

CIN - L32201GJ1988PLC010331

Regd. Office : Symphony House, Third Floor, FP12-TP50, Bodakdev, Off S. G. Highway, Ahmedabad - 380059, Tel: +91-79-66211111; E-mail ID - investors@symphonylimited.com; website: www.symphonylimited.com

NOTICE FOR LOSS OF SHARE CERTIFICATE(S)

Notice is hereby given that following share certificate(s) having FV of Rs. 10/- each of the Company have been reported lost/stolen/misplaced and the member(s)/their Claimant(s)/legal heir(s)/have lodged claims to get duplicate share certificate(s) having FV of Rs. 2/- each from the Company/IEPF Authority:

Name of Member(s)	Folio No.	Old Share Certificate No.	Distinction Nos. From	To	No. of Shares FV Rs.10/-
Meena Mishra	014892	26420	6608901	6609000	100
Jt. Satish Chandra Mishra	008336	19656	5932501	5932600	100
Pushpa Bai	016292	27932	6760101	6760200	100

Any person who has claim in respect of the aforesaid share certificate(s) should lodge his/ her claim to the Company at its registry office within 10 days from date of publication of this notice, failing to which the Company will proceed to issue duplicate share certificate(s) / dematerialize share certificate(s) / return their unclaimed shares / process their IEPF claim and also note that claim will be processed only if the documents are found in order and Company is satisfied with the same.

For, SYMPHONY LIMITED
Sd/
Mayur Barvadiya
Company Secretary

Date : April 6, 2022
Place : Ahmedabad

Business Brief

Equities extend losses; MPC meet in focus for fresh cues

New Delhi, April 6 (IANS) The benchmark indices -- Sensex and Nifty -- extended their losses for the second consecutive session on Wednesday primarily due to profit booking after a consistent rally in recent sessions. At 9.45 a.m., Sensex was 0.6 per cent or 347 points down at 59,830 points, whereas Nifty 0.7 per cent or 125 points down at 17,833 points.

Among the individual stocks, HDFC Bank, HDFC, Bajaj Auto, Kotak Mahindra Bank, and Axis Bank were the top five losers among the Nifty 50 companies, while NTPC, Coal India, UPL, Tata Steel, and BPL the top five gainers, NSE data showed.


For fresh cues, the outcome of the Reserve Bank of India's upcoming Monetary Committee Policy (MPC) meeting starting Wednesday would be eyed by the investors.--IANS

TCS, Accenture, Cognizant lead Indian firms amid digital boom

New Delhi, April 6 (IANS) As digital transformation gets in top gear, IT companies lead the pack and the top 3 firms are Tata Consultancy Services, Accenture and Cognizant, respectively, ramping up IT investments and hiring, a Microsoft-owned LinkedIn report said on Wednesday.

This time, 11 out of the top 25 companies are from the IT and service industry. To put together the annual 'Top Companies in India' list, LinkedIn looked at platform data across seven pillars: ability to advance, skills growth, company stability, external opportunity, company affinity, gender diversity, and educational background. With 23 out of the 25 top companies having offices in Bengaluru, the city has reinforced its reputation as the "Silicon Valley of India".

"The companies on the list are at the vanguard of refreshed organisational policies that foster young talent, promote retention by upskilling, and boost women representation in the workforce," said Nirajita Banerjee, India Managing Editor, LinkedIn. "By leaning on such policies, India's top companies are creating more employment and skilling opportunities that aid career progress in today's disruptive world of work," she added.



Last-mile delivery provider Shadowfax to ride on Hero EV

New Delhi, April 6 (IANS) Electric two-wheeler company Hero Electric on Wednesday announced a partnership with Shadowfax Technologies, India's leading crowdsourced platform for last-mile deliveries. Hero Electric will assist Shadowfax in converting 25 per cent of its 100,000-strong delivery fleet into EVs primarily with its Hero NYX HX electric two-wheeler.

"Industry this year will witness upward growth and faster transformation of B2B fleets across the country given the strengthening infrastructure," said Naveen Munjal, Managing Director, Hero Electric.

"This association will aid us in enabling carbon-free mobility in the logistics market and cater to consumer needs of last-mile delivery offered by Shadowfax," Munjal added.

Shadowfax recently shared plans for rapid electrification of the fleet and aims to move to 75 per cent electric vehicles by 2024. "In addition to boosting our pursuit of a greener, cleaner environment, it (the partnership) will provide earning opportunities for all," said Abhishek Bansal, Co-founder and CEO of Shadowfax Technologies.



Google forms Data Cloud Alliance to make data more accessible

San Francisco/New Delhi, April 6 (IANS) Google on Wednesday announced a new Data Cloud Alliance to make data more portable and accessible across business systems, platforms and environments -- with a goal of ensuring that access to data is never a barrier to digital transformation.

The alliance has Accenture, Confluent, Databricks, Dataiku, Deloitte, MongoDB, Redis, Starburst and others as founding partners. The members will provide infrastructure, application programming interfaces (APIs), and integration support to ensure data portability and accessibility between multiple platforms and products across multiple environments. By 2023, 60 per cent of organisations will use three or more analytics solutions to build business applications to connect insights to actions. "To provide organisations the flexibility, interoperability and agility to accelerate data-driven transformations, we have significantly expanded our data cloud partner ecosystem, and are increasing our partner investment across a number of new areas," said Sudhir Hasbe, Director of Product Management at Google Cloud.

Equity indices settle low, HDFC twins share decline

New Delhi, April 6 (IANS) Continuing with early session losses, the benchmark indices -- Sensex and Nifty - settled Wednesday's session in the red due to continued profit booking by investors.

Also, the benchmark indices were muted due to drop in HDFC group stocks after the recent steep rally post the announcement of their merger, said Vinod Nair, Head of Research at Geojit Financial Services.

Accordingly, Sensex settled 0.9 per cent or 566 points down at 59,610, whereas Nifty dipped 0.8 per cent or 150 points down at 17,807.

Among the individual stocks, HDFC Bank, HDFC, HDFC Life, HCL Technologies, and Tech Mahindra were the top five losers among the Nifty 50 companies during the session, tanking 3.6 per cent, 3.3 per cent, 2.4 per cent, 2 per cent, and 2 per cent, respectively.

Coal India, NTPC, Tata Steel, Power Grid Corporation of India, and BPL were the top five gainers. "We can expect volatility in the near-term ahead of the RBI policy meet which is expected to hold the rates but increase inflation forecast," Nair added.

For fresh cues, the outcome of the Reserve Bank of India's upcoming Monetary Committee Policy meeting starting Wednesday would be eyed by the investors.